

## સ્ટાટ્યુન્ક્ઝેક્સપ્રેસ

વાર્ષિક લવાજમ ૩.૨૦૦  
એક અંક ૩.૨૦

: માલિક, મુદ્રક, પ્રકાશક :

મોંડીબેન બાલવિહાર વતી  
બિપિન શાહ

: પ્રકાશન અને મુદ્રણાઃ

મોંડીબેન બાલવિહાર  
આંભાવાડી, ભાવનગર  
(૦૨૭૮) ૨૨૦૮૨૨૦

[www.sciencecity.co.in](http://www.sciencecity.co.in)

email : [sciencecity.bhavnagar@gmail.com](mailto:sciencecity.bhavnagar@gmail.com)  
facebook: [is.gd/fbscty](https://www.facebook.com/is.gd/fbscty)

: તત્ત્વી :

બિપિન શાહ

: સંપાદક સમિતિ :

માયા કુંવરાણી  
અશ્વિન પ્રજાપતિ  
ડૉ. રસિકલાલ કવા  
ડૉ. અરૂણ દવે

ડૉ. નલિન પંડિત  
ડૉ. હિતેખ શાહ

: કમ્પ્યુટર કાર્ય :

કીર્તિસિંહ વાળા

: આવરણ :

રવિ સોલંકી



: સલાહકાર સમિતિ :

ડૉ. અનિલ કાણે  
ડૉ. મુનિકુમાર મહેતા  
ડૉ. અનામિક શાહ

Financial Assistance by  
CSIR -New Delhi

સહયોગી સંસ્થા : વિકાસ વર્તુળ ટ્રસ્ટ



# પરમાણુ ક્રમાંક

૫



કરામત : પેપરમાંથી સસલુ

૬



સંયોજન : જીવસૂદ્ધ માટે અગત્યાનું  
સંયોજન પાણી

૭




રસરંજન : વિવિધ રોગોનું ઔષધ : વાનરપૂંછ  
(પાણાફાડ)

૧૮

ટેકનોલોજી : વાયુઅ૦માંથી વોલ્ટેજ

૨૬



આરોગ્ય : રોગપ્રતિકારક શક્તિ કેમ વધારવી ?

૪૦

કુદરત : વાઈરસ - પ્રેરિતવાત : કેસાન્ડ્ર કોસિંગ

પદ્ધો

૦૪

પ્રયોગશાળા

૨૪

ગણિતજ્ઞ

૧૧

દેશી એડિસન

૨૮

પ્રત્યાધાત

૧૨

શિક્ષક સેટુ

૨૬

વિટામિન

૧૩

પર્યાવરણ

૩૦

એકસ-રે

૧૪

કુતૂહલ

૩૨

બ્રેઇન એક્સ રે

૧૫

પ્રોજેક્ટ

૩૩

સાયલર કાફે

૧૬

શોધકથા

૩૪

નેનોન્યૂઝ

૧૭

ગણિત - મોડલ

૩૬

મેધિનુષ્ય

૨૦

સાહસિકોની સૃષ્ટિ

૩૭

મગાજમારી

૨૧

દૃષ્ટિભ્રમ

૩૯

અજાયબ ઘર

૨૨

પચગંભર

૪૨

જુનનો સંસ્થા અહેવાલ

૨૩



નોટીસ  
બોર્ડ  
માટે

## ગુજરાતના ધો.૪ થી કોંપ્લેઝના વિદ્યાર્થીઓ માટે...

**હેતુખો :** ISO-ICO ની પરીક્ષા દ્વારા ભાગકોમાં વિજ્ઞાન-ગણિત, કમ્પ્યુટર અને લોજુક અંગે વલણ વિકસે, સર્જનાત્મકતા કેળવાચ અને સવાર્ગી વિકાસ થાય.

UPSC, GPSC, RBI, SBI, IPS, SSC, LIC, INDIAN RAILWAY વગેરેની સ્પધાત્મક પરીક્ષા માટે સજ્જ બનો, આત્મવિશ્વાસ કેળવો અને સફળતા મેળવો.

**ISO ફી : રૂ.૫૦**

તારીખ : ૦૩-૧૨-૨૦૨૦ (ફેરફારની શક્યતા)

વિભાગ : ધો.૪ થી ધો.૧૦નાં ૭ વિભાગ

સમય : ૬૦ મીનિટ - ૧૦.૦૦ થી ૧૧.૩૦ કલાક

માળખું : વિજ્ઞાન - પર્યાવરણ આધારીત MCQ

**ICO ફી : રૂ.૫૦**

તારીખ : ૧૦-૧૨-૨૦૨૦ (ફેરફારની શક્યતા)

વિભાગ : ધો.૫ થી ધો.૧૨ અને કોલેજ-૭ વિભાગ

સમય : ૬૦ મીનિટ - ૧.૩૦ થી ૩.૦૦ કલાક

માળખું : કમ્પ્યુટર, IT, IQ તથા મેથ્સ આધારીત MCQ



SCAN ME

સ્થળ (કેન્દ્ર) :  
આપની શાળા

માધ્યમ :

ગુજરાતી / English

પદ્ધતિ :

Online / Offline

ફુરાણા

- ૭૨૧ વિદ્યાર્થીઓ માટે રૂ.૫૦ લાખના ઈનામો.
- બજેટો ઓલિમ્પિક્યાડના વિજેતાઓને સાચન્સ એક્સપ્રેસ નિઃશુલ્ક મળશે.
- વિજેતાઓને પુરસ્કારનો ચેક તથા દરેક ભાગ લેનારને રંગીન સર્ટીફીકેટ મળશે.
- બજેટો ઓલિમ્પિક્યાડમાં તૈયારી માટે વિષયલક્ષી માર્ગદર્શિકા વિનામુલ્યે મળશે.

આચ્છાદન



સહ્યોગી શુભેચ્છા

Pidilite Industries Limited




ઓનલાઈન  
રજીસ્ટ્રેશન માટે  
વેબસાઈટ જુઓ

ફોન નં. ૦૨૭૮-૨૨૦૫૨૨૦/૨૨૦૬૨૨૦, ઈમેઇલ : sciencecity.bhavnagar@gmail.com, વેબસાઈટ : www.sciencecity.co.in, ફેસબુક : is.gd/fbscty



# Paper rabbit



(1) Take paper and fold diagonally (2) Open and fold second diagonal in the other direction as shown in fig2 (3) Upturn paper and fold a plus sign (4) Collapse the paper in center to make "water bomb" base (5) Lift and fold tips of top triangle to the apex (6) Fold the paper tips to the center as shown in fig.6 (7) Tuck the flap in the pocket as shown in fig 7 (8) Tuck other side flaps in their pockets (9) Up turn paper and fold both left and right slant edges to the midline. The model will now look like a wasp (10) Fold the bottom corners like a kite as shown in fig 10 (11) Fold to make the mouth and ears of the rabbit as shown in fig. 11. (12) The rabbit give the shape as shown in fig 12 (13) It look likes a body of rabbit as per fig. 13 (14) Blow air in the hole in as fig 14 (15) Fix eye ball on the place of eyes as shown in fig 15. Your rabbit is ready now,,, Enjoy. Write about rabbit.



## બાળ પેણાનિક

# ચાલો બનાવીએ બલૂન સ્પીનર

આકૃતિ ૧

### MATERIALS



(૧) આકૃતિ ૧ માં દર્શાવ્યા પ્રમાણે એક વળેલી સ્ટ્રો, ફુંગો, રબ્બરબેન્ડ, ટાંકણી અને ખાલી પેનની રીફીલ લો.

આકૃતિ ૨



POKE A PIN NEAR THE CENTER OF A BENT STRAW

(૨) આકૃતિ ૨ મુજબ વળેલી સ્ટ્રોના મધ્યભાગમાં ટાંકણીની મદદથી કાણું પાડી ટાંકણી પસાર કરો.

(૩) આકૃતિ ૩ માં દર્શાવ્યા પ્રમાણે જે લાંબો ભાગ છે તાં રબ્બરબેન્ડની મદદથી ફુંગો બાંધો.

આકૃતિ ૩

TIE A BALLOON ON THE RIGHT END OF STRAW WITH A RUBBER BAND



આકૃતિ ૪

PLACE THE PIN IN A OLD BALL PEN REFILL (REFILL WILL AS A BEARING)

(૪) આકૃતિ ૪ માં દર્શાવ્યા પ્રમાણે ટાંકણીને પેનની રીફીલમાં રાખો. તમે પેનની રીફીલને બદલે પાતળી સ્ટ્રો પણ લઈ શકો છો.



આકૃતિ ૫

(૫) આકૃતિ ૫ માં દર્શાવ્યા પ્રમાણે રીફીલને હાથમાં પકડી સ્ટ્રોના બીજા છેદેથી ફુંગાને કુંક મારીને ફૂલાવો અને તરત જ તે છેડા પર હાથ રાખો. જેથી ફુંગામાંથી હવાનીકળી ન જાય.



આકૃતિ ૬

(૬) હવે સ્ટ્રોના બીજા છેડા પરથી હાથ હટાવી લો. જેમ જેમ હવા બહાર આવશે તેમ તેમ સ્ટ્રો ગોળ ફરવા લાગશે. તમારું રમકું તૈયાર છે. તમે તેનો આનંદ માણો અને તમારા મિત્રને પણ બતાવો.


(૧) આ રમકડામાં વળેલી સ્ટ્રોના બદલે સીધી સ્ટ્રોનો ઉપયોગ કરીએ તો શું પરિણામ મળે?

(૨) ફુંગામાં વધારે હવા હશે ત્યારે સ્ટ્રો ઝડપથી ફરશે કે હવા ઓછી થશે ત્યારે ઝડપથી ફરશે?

(૩) જો ફુંગાને સ્ટ્રોના ટુકાં ભાગ પાસે બાંધવામાં આવે તો સ્ટ્રોની ગતિમાં શું ફેરફાર થાય?



## સંયોજન



# જીવસૂચિ માટે અગત્યનું સંયોજન પાણી

પાણી એ પૃથ્વીની અંદાજે ૭૦% જગ્યા રોકતો અને માનવજીત તેમજ સમગ્ર જીવસૂચિ માટે સૌથી અગત્યનો અને વિપુલ પ્રમાણમાં મળતો પદાર્થ છે. તે કુદરતી રીતે વાતાવરણમાં ભેજ તરીકે, જમીન ઉપર તેમજ પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. પાણી વગર જીવસૂચિનો સંભવ જ નથી. માનવજીત ખોરાક વગર કદાચ અમુક દિવસો ચલાવી શકે પરંતુ પાણી વગર બહુ ઓછો સમય કાઢી શકે. પાણીની અછત ઘર અને શેરીના ઝડપાથી શરૂ કરી વિશ્વયુદ્ધ સુધી વિસ્તરી શકે છે.

પાણીના સામાન્ય ગુણધર્મો જોઈએ. તેનું રાસાયણિક સુત્ર  $H_2O$  છે. તે હાઈડ્રોજન અને ઓક્સિજનનું ૨:૧ ના પ્રમાણમાં મળતું સંયોજન છે.

તેનો અણુભાર ૧૮ ગ્રામ/મોલ છે. તેની ઘનતા મહત્તમ ૧ gm/cc છે.

તેને ગરમ કરતા  $0^{\circ}\text{C}$  થી  $4^{\circ}\text{C}$  સુધી તેનું અનિયમિત કદ પ્રસરણ જોવા મળે છે.

શુદ્ધ અને ચોખ્ખા પાણીની pH 7 હોય છે.

તેમાં બે હાઈડ્રોજન પરમાણુ, ઓક્સિજન સાથે

સીધી રેખામાં જોડાવાને બદલે  $104^{\circ}$  ૪૫'ના ખૂણે જોડાયેલ હોય છે.

પાણીધન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે.

- પાણીની એક અન્ય વિશેષતા એ છે કે તે તેના પ્રવાહી સ્વરૂપ કરતાં ઘન સ્વરૂપની ઘનતા ઓછી છે.


મિત્રો શું તમને ખબર છે, પાણી પર બરફ કેમ તરે છે? ચાલો સમજીએ. પાણીના ઘનસ્વરૂપ (બરફ) અને પાણીના પ્રવાહી સ્વરૂપ (પાણી)ની ઘનતા જુદી જુદી છે. પ્રવાહી સ્વરૂપ કરતાં ઘન સ્વરૂપની ઘનતા ઓછી છે માટે જ પાણી પર બરફ તરે છે.

પાણીને  $4^{\circ}\text{C}$  સે થી  $0^{\circ}\text{C}$  સે સુધી ઠંડુ પાડતા કદ ઘટવાના બદલે વધે છે અને ઘનતા ઘટે છે, જેને અનિયમિત કદ પ્રસરણ કરે છે. આ વિશિષ્ટ ગુણધર્મને લીધે બરફ પાણી પર તરે છે.

વરસાદથી મળતું પાણી સૌથી વધારે શુદ્ધ હોય છે. વરસાદના પાણીમાં વાતાવરણમાં રહેલા વાયુઓ દ્રાવ્ય થાય છે. જ્યારે આ પાણી પૃથ્વી પર પડે ત્યારે તેમાં માટી-રેતીના રજકણ, બીજા અકાર્બનિક અને કાર્બનિક અશુદ્ધિઓ ભળે છે.

તળાવ કે સરોવરના પાણીમાં કારનું પ્રમાણ ઓછુ હોય છે જ્યારે સમુક્રનું પાણી ખૂબ જ કારયુક્ત હોય છે. જમીનમાંથી જુદી જુદી ઊંડાઈએથી મળતા પાણીમાં કારનું પ્રમાણ જુદુ જુદુ હોય છે. કુદરતમાંથી મળતા પાણીમાં દ્રાવ્ય ક્ષારને આધારે તેના બે પ્રકાર પડે છે.

(૧) નરમ પાણી : જે પાણીમાં કપડાં ધોતી વખતે સાખુના ફીઝા સહેલાઈથી વળે અને સાખુ ઓછો વપરાય તેવાં પાણીને નરમ પાણી કહે છે. નરમ પાણીમાં કેલ્શિયમ



અને મેળેશિયમના ક્ષારોનું પ્રમાણ નહિવત હોય છે.

(૨) કઠિન પાણી : જે પાણીમાં કપડાં ધોતી વખતે સાબુના ફીણા ઓછા વળે અને સાબુ વધારે વપરાય તેવા પાણીને કઠિન પાણી કહે છે. આવા પાણીમાં કેલિશિયમ અને મેળેશિયમના બાયકાર્બોનેટ્સ, ક્લોરાઇડ અને સલ્ફેટના ક્ષારો ઓગળેલા હોય છે.

પાણીની કઠિનતાને પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે.

### કામચલાઉ (ક્ષણિક)

કઠિનતા : (Temporary Hardness)

જે પાણીમાં કેલિશિયમ બાયકાર્બોનેટ  $\text{Ca}(\text{HCO}_3)_2$  અને મેળેશિયમ બાયકાર્બોનેટ

$\text{Mg}(\text{HCO}_3)_2$  ના ક્ષારો દ્વારા થયેલા હોય તેવા પાણીની કઠિનતાને કામચલાઉ (ક્ષણિક) કઠિનતા કહે છે. આવી કઠિનતા પાણીને ઉકાળવાથી દૂર કરી શકાય છે. પાણીને ઉકાળતા ક્ષારોનું વિઘટન થતાં કઠિનતા દૂર થાય છે અને અદ્રાવ્ય પદાર્થોને ગાળાણ પ્રક્રિયાથી દૂર કરાય છે.



(૨) કાયમી કઠિનતા : (Permanet Hardness)

જે પાણીમાં કેલિશિયમ ક્લોરાઇડ ( $\text{CaCl}_2$ ) મેળેશિયમ ક્લોરાઇડ ( $\text{MgCl}_2$ ) કેલિશિયમ સલ્ફેટ ( $\text{CaSO}_4$ ), મેળેશિયમ સલ્ફેટ ( $\text{MgSO}_4$ ) ના ક્ષારો દ્વારા થયેલા હોય તેવા પાણીની કાયમી કઠિનતા કહે છે. આ કાયમી કઠિનતા દૂર કરવા માટે કેટલીક રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

આપણે રોજિંદા વપરાશ માટે અઠળક પાણીનો

ઉપયોગ કરીએ છીએ. આપણો જે વસ્તુઓ દૈનિક જીવનમાં વાપરીએ છી એ તેને બનાવવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. જેમ કે કાગળ, અનાજ, ખાદ્યપદાર્થો, દવાઓ, વીજળી, વગરે...

આપણે અહીં વિકાસ પામેલા દેશ અને આપણા દેશનાં અમુક ઉદ્યોગો ચાલે છે તેના પાણી વપરાશની સરખામણી જોઈએ.

એક મેગાવોટ વીજળીના ઉત્પાદનમાં વિકસિત દેશોમાં આશરે ૧૦,૦૦૦ લિટર પાણીનો વપરાશ છે તેની સામે ભારતમાં અંદાજે આશરે ૮૦,૦૦૦ લિટર પાણી વપરાય છે. એક ટન રૂ માંથી કાપડ બનાવવા માટે વિકસિત દેશોમાં ૧,૦૦,૦૦૦ લીટરના

વપરાશ સામે ભારતમાં ૧,૫૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ લિટર પાણી વપરાય છે. ૧ ટન કાગળ બનાવવા માટે ૫૦,૦૦૦ લિટરના વપરાશની સરખામણીમાં ભારતમાં દોડ લાખ થી બે લાખ લિટર પાણીની જરૂરિયાત પડે છે.

શું ભારતમાં આ પાણીનો બચાવ કરી શકીએ ? વિચારો... કેવી રીતે શક્ય બનાવી શકાય ?

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આલ્કોહોલ-બીયર બનાવવાની આશરે ૧૦ ફેક્ટરીઓ આવેલી છે અને દરરોજ આ ફેક્ટરીઓ ૩.૫ કરોડ લિટર પાણીનો ઉપયોગ કરે છે. મહારાષ્ટ્રમાં આશરે બે લાખ હેક્ટર જમીન પર શેરડી ઉગાડવામાં આવે છે જેનો ઉપયોગ મોટે ભાગે ખાંડ બનાવવામાં થાય છે. મહારાષ્ટ્રમાં ૨૦૦ કરતાંય વધુ ખાંડ બનાવવાની ફેક્ટરીઓ આવેલી છે અને તે રોજના ૨૫ લાખ લિટર પાણીનો ઉપયોગ કરે છે. ♦





## રસરંજન



આજકાલનાં કહેવાતા ચોમાસાની શરૂઆત સાથે સાથે ધણાં બધા વાયરલ રોગો ફેલાવાની શક્યતા વધતી જાય છે. તો કુદરતે આ રોગો સામે રક્ષણ મેળવવા કેટલીક ઔષધિય વનસ્પતિ આપણી આસપાસની જગ્યામાં ખીલવી આપી છે. જો તમારું અવલોકન સારું બનાવો તો તમે ધણી બધી વનસ્પતિઓ તમારી આસપાસની જગ્યામાં જોઈ શકશો. આવી વનસ્પતિઓને ઓળખીએ અને તેનું મુલ્ય સમજુએ. ચાલો આજે સમજુએ આવી આસપાસ જોવા મળતી કે ટલીક ઔષધિય વનસ્પતિ ઓ માં ની એ ક વાનરપૂંછ/પાણાફાડ /પરદેશી ભાંગરો.

આ વનસ્પતિને ગુજરાતીમાં "વાનર પૂંછ" ત્રદ્ધ પ્રોકુમબેસન કહેવામાં આવે છે. જેનું વૈજ્ઞાનિક નામ *Tridax Procumbens (L)* છે.

આ હર્બ પ્રકારની વનસ્પતિ કમ્પોઝિટી (એસ્ટરેસી) કૂળની સભ્ય છે. જેનું મૂળ મધ્ય અમેરિકા મનાય છે. અને સમગ્ર વિશ્વમાં વિસ્તરેલ છે. ભારતમાં પણ તે નીંદણ (weed) સ્વરૂપે ૨૪૦૦ મીટર ઉંચાઈ સુધી જોવા મળે છે. અંગ્રેજી ભાષામાં તેને કોટ બટનસ, મેક્સીકન ડેઇઝી; હિન્દીમાં તેને કલાલ, કન્કૂલી, કુમરા; કન્ડમાં શાવન્તી, ગબ્બુ શાવન્તી, કાચગની, ઈલીસયું અને સંસ્કૃતમાં જયંતી થી ઓળખાય છે.

આ વનસ્પતિ વનવગડામાં ખેતરોમાં પથરાળ



## વિવિધ રોગોનું ઔષધ : વાનરપૂંછ (પાણાફાડ)

વિસ્તારમાં નીંદણ તરીકે ઉગ્નિ નિકળે છે. તે છોડ (હર્બ) સ્વરૂપની દ ઈચ્છાથી લઈ ૧૮ ઈચ્છ જેટલી ઉંચાઈ ધરાવે છે. તેના પાન સાદા, સંદર્ભી, માંસલ (દળદાર) અને સામસામે (સન્મુખ) ગોઠવાયેલા હોય છે. પણોની કિનારી દાંતાવાળી અને તેની બંને સપાટી પર રોમ (વાળ જેવી રચના) આવેલ હોય છે. પુષ્પો લાંબા પુષ્પવિન્યાસ દંડ ઉપર અગ્રભાગે સ્તબક પુષ્પવિન્યાસમાં પુષ્પકો ખીલે છે. જેથી પુષ્પ વચ્ચેથી પીળા રંગનું અને બહારનો ભાગે સહેદ પાંદરી (ત્રશ ખાંચવાળી) જેવી રચના ધરાવે છે. એક છોડમાંથી આશરે ૧૫૦૦ પાણાફાડનો પુષ્પવિન્યાસ દંડ વાનરની પુંછડી જેવો લાંબો હોઈ તેને વાનરપૂંછ તરીકે ઓળખવામાં આવે છે.

પાણાફાડ સ્વાદે તુરી ને કડવી, તાસીરે શીત, શોચહર (સોજો ઉતારનાર) રક્ત સ્તમ્ભક (ધા માંથી લોહી બંધ કરનાર), વર્ણરોપક (રુઝ લાવનાર) કિટાશુનાશક, કેશ્ય, પીડાહર, રોગપ્રતિકારક, જવરહર (તાવ હરનાર) અને મુત્રલ ગુણધર્મો ધરાવે છે.

આ છોડમાં પ્રોકુમબેટીન નામનો ફ્લેવોનોઇડ, ફ્લેવોનોઇડ, પ્રોકુમબેટીન, ટેનનિ, વિટામીન-એ અને લેનોલેનીક એસીડ વગેરે ઘટકો હોય છે. તેના પાનમાં કેલ્શિયિમ, મેનેશિયિમ, પોટેશિયિમ, સેલેનીયિમ, સોડીયિમ અને લોહીતત્ત્વો હોય છે. પર્ણના રસમાં કાર્બોહાઇદ્રેટ, પ્રોટીન્સ, ટેનિન, સ્ટ્રીરોઇડ, આલ્કોલોઇડ અને પ્યુરીન જોવા મળે છે.

ભારતીય પરંપરાગત ચિકિત્સામાં એન્ટીકોઅન્થ્રોપોલોજી, એન્ટીડીસેન્ટીક, એન્ટીડીઅરચિલ તરીકે ઉપયોગમાં લેવાય છે. વાળ વધારવા ટોનિક તરીકે અને તાજા જખમો, ઘા અને વહેતા લોહીને બંધ કરવા પાનના રસનો ઉપયોગ કરવામાં આવે છે. આચુર્વેદ મુજબ તેનો ઉપયોગ યકૃત, વિકાર, સંધીવા, હાર્ટબર્ન અને વાળ વૃદ્ધિ માટે થાય છે.

ત્રદ્ધ પ્રોકુમબેન્સ વાનરપૂંછ (પાણાફાડ) વનસ્પતિનો ઉપયોગ બેક્ટેરીયલ ચેપ, સંધીવાનો દુખાવો, બળતરા, પેટનું ફૂલવું, તાવ, હાઈપરટેન્શન, ગડગુમડ, લોહીવા, રક્તપિત (એસીડીટી), કમળો અને કેન્સરમાં થાય છે.

નાઈજીરીયામાં પાનનો ઉપયોગ બ્લડ પ્રેશર ઘટાડવા માટે, આફિકામાં સુકા છોડનો ઉપયોગ તાવ, કષ, કમરનો દુખાવો, ઝડપ, વાઈ માટે થાય છે. સુકા

પાંદા મેલેરિયામાં વપરાય છે. પશુ ઘનમાં મસ્તાઈટીસની સારવારમાં તે ઉપયોગી છે.

વાનરપૂંછ (પાણાફાડ)નાં તાજપાનની લુગદી ગડગુમડ, ચીરા, પગનાં વાઢીયા, ઊરડા, જખમમાંથી લોહી નીકળવું દુઝતા, હરસ, ફીસર વગેરે ઉપર લગાડવાચી ફાયદો થઈ શકે છે.

પાણાફાડના પાંચેય અંગો (પંચાગ) મૂળ, પ્રકાંડ, પણ, ફૂલ અને ફળને પાણીથી ધોઈ તેનો રસ પાયોરિયા, લોહીયા, પ્રોસ્ટેટનો સોજો, મરડો, શરદી, અમ્લપિત, કમળો, તાવ, કેન્સર, મધુપ્રમેહ, ગળાનો સોજો, વાળ ખરવા, ઉધરસ, શ્વાસ, પાંડુરોગ વગેરેમાં પ્રયોજી શકાય છે.

ચાલો આપણો આપણી આજુબાજુનાં વિસ્તારમાંથી શોધીએ વાનરપૂંછ/પાણાફાડ અને તેનો અભ્યાસ કરીએ.

## ‘દેશી એડિશન’ સંધાન પાના નં. ૨૮ ઉપરથી

જીવાણું મુક્ત કરવામાં આવે છે. આ પ્રયત્ન અમદાવાદનાં સ્ટેટ્સ ટાવર થલતેજનાં રહીશ દ્વારા તૈયાર કરવામાં આવેલ. જેમાં એક લાકડાનાં બોક્સમાં ચારેબાજુ અને ઉપરની બાજુએ એમ ૮ જેટલાં અલ્ટ્રાવાયોલેટ લેભ્યુ ગોઠવવામાં આવેલાં છે. જેમાં યોગ્ય તીવ્રતાવાળો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ મળે તેવી ગોઠવણ કરવામાં આવી છે તેમજ સલામતી માટે સેન્સરનો ઉપયોગ કરવામાં આવેલ. તેમના મત મુજબ ૪૦ સેકેન્ડમાં ખાદ્ય વસ્તુઓ પરનાં જીવાણું, કીટાણું, વાઈરસનો નાશ કરી તેને જંતુમુક્ત કરે છે. આ બોક્સ બિલ્ડિંગનાં મેર્ચિનગેટ પર મૂકી દરેક સભ્યોના ઘરમાં લાવવામાં આવતી વસ્તુઓને જંતુરહિત કરવામાં આવે છે.

### ખાંઝમા બ્રશ : (Plasma brush :)

મેડિકલના સાધનો, માસ્ક અને અન્ય ઈન્સ્ટ્રુમેન્ટને સ્ટ્રીલાઇઝ કરવાં માટે ખાંઝમા બ્રશ વપરાય છે. કોવિડનાં દર્દીઓ માટે વપરાતા સાધનો, સર્જિકલ માસ્ક, ગલોઝ અને અન્ય સાધનો બનાવવા લાગતાં લાંબા

સામયગાળામાં તેઓ સ્ટ્રીલાઇઝ કરીને ઉપયોગ કરવા માટે ‘ખાંઝમા બ્રશ’ તૈયાર કરેલ છે. જે માટે NSF દ્વારા ટીમને એવોઈથી

સન્માનિત કરી આગળનાં સંશોધન માટે નાણાકીય મદદ આપવામાં આવી. ખાંઝમા બ્રશમાં આયોનાઇઝ ગેસ ચાર્જ પાર્ટિક્લસનાં સ્વરૂપમાં હોય છે જે અસરકારક રીતે સુક્ષમજીવાણુઓને નિષ્ક્રિય કરે છે. સામાન્ય રીતે ખાંઝમા ખુબ ઉંચા તાપમાને હોય છે પરંતુ તેને કોલ એટમોરસ્ફીયરીક ખાંઝમામાં રૂપાંતર કરવામાં આવે છે. જે સલામત રીતે મેડિકલના સાધનો, સર્જિકલ માસ્ક અને ગલોઝ જેવા મટીરીયલ્સને સ્ટ્રીલાઇઝ કરીને ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે.

